

પ્રવર્તમાન કોવીડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને માન. કુલપતિશ્રી, આ.કૃ.યુ.,
આણંદનું વિદ્યાર્થીઓને ઓનલાઇન સંબોધન

નોવેલ કોરોના વાઇરસ (કોવિડ-19) ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં હાલમાં કોરોના કેસમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. સમગ્ર વિશ્વ વર્તમાન સમયમાં સંકટના ઘણા મોટા ગંભીર સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે. પ્રવર્તમાન કોવીડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને કોવીડ-૧૯ અટકાવવા અને જાગૃતિ લાવવા તા.૧૫/૦૫/૨૦૨૧ ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦ કલાક દરમિયાન ડૉ. કે.બી. કથીરીયા, માન. કુલપતિશ્રી, આ.કૃ.યુ., આણંદ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન સંબોધન કરવામાં આવેલ. જેમાં ડૉ. એમ.કે. ઝાલા, સંશોધન નિયામક અને અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષશ્રી, ડૉ.એચ.બી. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો.જી. આર. પટેલ, કુલસચિવશ્રી, ડૉ.ડી.આર. કથીરીયા, નિયામકશ્રી, આઇ.ટી. અને ડૉ. દિનેશ એચ. પટેલ, નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ હાજર રહેલ. સદર કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટીની તમામ કોલેજ/પોલીટેક્નીકના આચાર્ય/ડીનશ્રીઓ, એસ.આર.સી. ચેરમેન, જનરલ સેક્રેટરી (GS) અને વર્ગ પ્રતિનિધિ (CR) સહિત કુલ ૨૦૧ વ્યક્તિઓ WEBEX દ્વારા ઓનલાઇન જોડાયેલ હતાં તથા યુનિવર્સિટીની તમામ કોલેજ/પોલીટેક્નીકમાંથી કુલ ૧૮૫૭ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને YOUTUBE ના માધ્યમથી લાઇવ નિહાળેલ.

માન. કુલપતિશ્રીએ પોતાના સંબોધનમાં સૌ પ્રથમ કોરોના મહામારી વિશે વિસ્તૃત છણાવટ આપી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારી સામે લેવાયેલ રક્ષણાત્મક પગલાંઓ વિશે સૌને માહિતગાર કરેલ. વધુમાં તેમણે કોરોનાના ફેલાવાને રોકવા માટે મહત્વપૂર્ણ સંદેશ આપેલ. જેમાં માસ્કનો નિયમિત ઉપયોગ, વારંવાર હાથ ધોવા, સામાજિક અંતર જાળવવું, ચહેરાને સ્પર્શ કરવાનું ટાળવું, રોગ પ્રતિકારકશક્તિ વધારવાના ઉપાયો વગેરે વિશે વિગતવાર સમજૂતી આપી હતી. ઉપરાંત તેઓએ વિદ્યાર્થીઓને કોરોના પ્રત્યે જાગૃત બનવા, અધ્યતન માહિતીથી વાકેફ થવા, સોશ્યલ મિડીયામાં નકારાત્મક સંદેશા ફેલાવા નહીં અને તેવા સંદેશાથી બચવા જણાવેલ. વિદ્યાર્થીઓને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરી વેક્સીન લેવી અને અન્ય લોકોને પણ રસી લેવા માટે પ્રેરીત કરવા જણાવ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓએ પોતાની સામાજિક અને નૈતિક જવાબદારીના ભાગરૂપે સંક્રમિત થયેલા લોકોને સાંત્વના આપવાનો પ્રયાસ કરી તેમને શક્ય તેટલી મદદ કરવા આહવાન કરેલ. વિદ્યાર્થીઓને તેમના ગામ તેમજ આજુબાજુના ગામના ખેડૂતોને કોરોનાના કપરાકાળમાં કૃષિની યોગ્ય માહિતી મળી રહે તે માટે મદદરૂપ થવા જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ.

દિનેશ એચ. પટેલ, નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ દ્વારા તેમજ WEBEX અને YOUTUBE દ્વારા ઓનલાઇન કાર્યક્રમનું પ્રસારણ ડૉ. ધવલ આર. કથીરીયા, નિયામકશ્રી, આઇ.ટી. દ્વારા કરવામાં આવેલ હતું.

